



ધી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા
આર.એન.ટી.સી.પી. પ્રોગ્રામ
વડોદરા મહાનગરપાલિકા

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં આર.એન.ટી.સી.પી. પ્રોગ્રામ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસનાં કરાર આધારિત તદન હંગામી ધોરણે ટી.બી.એચ.વી.ની ૩ જગા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા. ૦૬/૦૭/૨૦૨૧ (૦૦.૦૧ કલાક) થી તા. ૧૫/૦૭/૨૦૨૧ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.

નોંધ:- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર જગા ભરવા માટે ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે

ચેરમેન,

એક્ઝક્યુટીવ કમીટી

અને ડે.મ્યુનિસિપલ કમિશનર

વડોદરા મહાનગરપાલિકા

પી.આર.ઓ. નં ૨૭૮/૨૧-૨૨



ધી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા
આર.એન.ટી.સી.પી. પ્રોગ્રામ
વડોદરા મહાનગરપાલિકા

ભરતી માટેની જાહેરાત

(જાહેરાત ક્રમાંક: ૨૭૮/૨૦૨૧-૨૨)

ક્રમ	જગ્યાનું નામ	કુલ જગ્યા	શૈક્ષણિક લાયકાત	ફિક્સ પગાર (પ્રતિ માસ)
૧	ટી.બી.એચ.વી- RNTCP પ્રોગ્રામ	૩	(૧) સ્નાતક અથવા (૨) ઇન્ટરમીડીએટ (૧૦+૨) અને MPW/LHV/ ANM/હેલ્થ વર્કરની કામગીરીનો અનુભવ અથવા આરોગ્ય સલાહકારનો ઉચ્ચતર સર્ટિફિકેટ કોર્ષ અથવા (૩) ટીબીએચવી નો માન્ય સંસ્થામાંથી કરેલ કોર્ષ (૪) કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્ષ (ઓછામાં ઓછો ૨ માસનો)	રૂ.૧૩,૦૦૦

જાહેરાતની સામાન્ય જોગવાઈઓ:

1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
2. રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૦૬/૦૭/૨૦૨૧ (૦૦-૦૧ કલાક) થી તા. ૧૫/૦૭/૨૦૨૧(૨૩-૫૯ કલાક) દરમિયાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
3. શૈક્ષણિક માહિતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ education qualification details માં ના હોય તો OTHER1 અને કોમ્પ્યુટર કોર્સ ની માહિતી OTHER2 માં ભરવી.
4. વયમર્યાદા: ૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.
5. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
6. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલ હોવો જોઈએ.
7. ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે.
9. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
11. આ જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
12. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

તા. ૦૫/૦૭/૨૦૨૧.

ચેરમેન

એક્ઝિક્યુટીવ કમિટી, અર્બન હેલ્થ સોસાયટી,
અને ડે.મ્યુનિસિપલ કમિશ્નર(વ)
વડોદરા મહાનગરપાલિકા